

Date: 31-05-2022

To,
Gen. Manager (DCS)
BSE limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 530477

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of audited financial results for the quarter and year ended on **31st March, 2022** in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **30th May, 2022**.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

FOR, VIKRAM THERMO (INDIA) LIMITED

For, VIKRAM THERMO (INDIA) LTD.


MANAGING DIRECTOR


MR. DHIRAJLAL K PATEL
MANAGING DIRECTOR
(DIN:00044350)

SURYAKRUPA FINANCE LIMITED				
CIN: L60200GJ1986PLC083845				
Regd. Office: Plot No. 267, Ward 12/B, Gandhidham, Gujarat-370201				
Email: investorsuryakrupa@gmail.com Website: www.suryakrupafinance.in Contact: 9979898027				
STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND YEAR ENDED ON 31 st MARCH, 2022				
(Rs. In Lakhs)				
Particulars	Quarter ended		Year ended	
	31.03.2022 Audited	31.03.2021 Audited	31.03.2022 Audited	31.03.2021 Audited
Total Income from Operations (net)	453.53	0.00	918.07	0.00
Net profit for the period (before Tax, Exceptional and Extraordinary items)	9.51	(1.16)	26.22	(7.03)
Net Profit for the period after tax (after Exceptional and Extraordinary Items)	9.51	(1.16)	26.22	(7.03)
Equity Share Capital (Face Value of Rs.10/- each)	100	100	100	100
Earnings Per Share Basic/ Diluted	(0.95)	(0.12)	(2.62)	(0.70)
Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the quarterly /Annual financial results are available on the Stock Exchange website: www.bseindia.com .				
For, Suryakrupa Finance Ltd. Sd/- Akansha pithaliya (Compliance Officer)				
Place: Gandhidham Date : 30/05/2022				

GALA GLOBAL PRODUCTS LIMITED				
Regd. Off.: B-1 , Laxmi Com. CO. Op. Estate, B/h Old Navneet Press, Sukhramnagar, Ahmedabad-380021 Phone: 079 22778955, 079 22772921 email: inf.galaglobal@gmail.com ; Website: www.galaglobalhub.com				
EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.03.2022				
Sr. N o.	Particulars	Quarted Ended 31.03.2022 (Audited)	31.03.2021 (Audited)	Year Ended 31.12.2022 (Audited)
1	Total Income from Operations	6510.67	3706.88	10338.61
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	66.75	35.93	173.63
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	66.75	35.93	173.63
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	70.69	125.03	131.10
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period(after tax) and Other Comprehensive Income (after tax)]	0.0	0.0	0.0
6	Paid up equity Share capital. (face value of Rs.5 each)	2729.40	2729.40	2729.40
7	Reserves(excluding revaluation reserves) as shown in the Audited Balance sheet of Previous year	1496.71	1365.60	1496.71
8	Earnings Per Share (for continuing and discontinued operations) - Basic & Diluted.(in Rs.)	0.13	0.23	0.24
Note : The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the websites of the Stock Exchange(s) and the listed entity. Date.: 28-05-2022 Place.: Ahmedabad				
For and on behalf of the board Sd/- Avani Shah (Managing Director)				

S.A.L. STEEL LIMITED						
Regd Off : 5/1, Shreeji House, B/h M.J. Library, Ashram Road, Ahmedabad - 380 006 CIN: L29199GJ2003PLC043148 Website : www.salsteel.co.in Email ID: sal.investor@salsteel.co.in						
Statement of Standalone Audited Financial Results for the Quarter and Year ended March 31, 2022 (pursuant to Regulation 47(1) (b) of SEBI (LODR) Regulations, 2015)						
(Rs. in crore except per share data)						
Sr No	Particulars	QUARTER ENDED (STANDALONE)			YEAR ENDED (STANDALONE)	
		31.03.2022 (Audited)	31.12.2021 (Unaudited)	31.03.2021 (Audited)	31.03.2022 (Audited)	31.03.2021 (Audited)
1	Total Income	186.48	135.78	132.66	534.53	322.87
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	7.40	0.11	17.66	16.25	12.42
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or extraordinary items)	7.40	0.11	17.66	16.25	12.42
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or extraordinary items)	4.95	0.07	15.56	11.55	11.56
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5.03	0.09	15.57	11.68	11.62
6	Equity Share Capital	84.97	84.97	84.97	84.97	84.97
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	-	-58.80
8	Earning Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
	1. Basic:	0.58	0.01	1.83	1.36	1.36
	2. Diluted:	0.58	0.01	1.83	1.36	1.36
Note : 1 The above is an extract of the detailed format of Quartely / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com and on Company's website viz. www.salsteel.co.in .						
For and on behalf of Board of Directors for S.A.L. Steel Limited Sd/- Rajendra V Shah (DIN : 00020904) Chairman						
Place: Santej Date : 28/05/2022						

SHAH ALLOYS LIMITED								
Regd Off : 5/1,Shreeji House, B/h M.J. Library, Ashram Road, Ahmedabad - 380 006 CIN: L27100GJ1990PLC014698 Website : www.shahalloys.com								
Extract of Audited Financial Results for the Quarter and Year ended March 31, 2022 (pursuant to Regulation 47(1) (b) of SEBI (LODR) Regulations, 2015)								
(Rs. in crore except per share data)								
Sr. No.	Particulars	STANDALONE				CONSOLIDATED		
		QUARTER ENDED		YEAR ENDED		QUARTER ENDED		YEAR ENDED
		31.03.2022 (AUDITED)	31.03.2021 (AUDITED)	31.03.2022 (AUDITED)	31.03.2021 (AUDITED)	31.03.2022 (AUDITED)	31.03.2021 (AUDITED)	31.03.2021 (AUDITED)
1	Total Income	257.91	207.42	906.91	530.78	257.91	207.42	906.91
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	25.40	26.54	130.12	30.45	32.48	30.05	109.36
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and / or extraordinary items)	25.40	42.73	130.12	46.64	32.48	46.24	109.36
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or extraordinary items)	21.56	(26.82)	102.87	(51.64)	28.64	(23.31)	82.11
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	21.43	(26.79)	102.84	(51.51)	28.51	(23.28)	82.08
6	Equity Share Capital	19.80	19.80	19.80	19.80	19.80	19.80	19.80
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-	(65.13)	-	-	-
8	Earning Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -							
	1. Basic:	10.89	(13.55)	51.96	(26.08)	14.46	(11.77)	41.47
	2. Diluted:	10.89	(13.55)	51.96	(26.08)	14.46	(11.77)	41.47
Notes: 1 The above is an extract of the detailed format of Quartely / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com and on Company's website viz. www.shahalloys.com .								
For and on behalf of Board of Directors for Shah Alloys Limited Sd/- Ashok Sharma (DIN : 00038360) Director & CFO								
Place : Santej Date : 28.05.2022								



Since 1965

Vikram

THERMO (INDIA) LTD.

Regd. Office : A/704-714, THE CAPITAL, Science City Road, Ahmedabad-380060, Gujarat, India

Phone: +91-79-48481010/11/12 E-mail: exports@vikramthermo.com

Website: www.vikramthermo.com

EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED ON 31-03-2022

(Rs.in Lakhs)				
Sr no	Particulars	Quarter ended on 31 st March, 2022	For the year ended on 31 st March, 2022	Corresponding 3 Months Ended on 31 st March, 2021
1	Total income from operations	2450.93	9333.18	1779.27
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	338.16	1176.54	162.98
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	338.16	1176.54	162.98
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	246.58	868.97	133.26
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	248.01	871.95	142.05
6	Equity Share Capital	627.16	627.16	627.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year		6719.88	
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)			
	Basic :	3.93	13.86	2.12
	Diluted :	3.93	13.86	2.12

Notes :

1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com) The same is also available on the Company's website at www.vikramthermo.com

2 The result of the quarter ended on 31st March, 2022 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 30/05/2022.

BY ORDER OF THE BOARD OF DIRECTORS,

FOR, VIKRAM THERMO (INDIA) LTD.

(D. K. PATEL)


[Managing Director]

(DIN 00044350)

Place: Ahmedabad

Date : 30/05/2022

Road & Building Department Government of Gujarat Tender Notice No. 10/2022-23			
On behalf of Governor of Gujarat State the Executive Engineer, R&B Division, Smith Bungalow, Opp. Officers' Club, College Road, Bhuj (Kachchh) Ph.No. (02832) 251450 / 250424 invites online tender for the work mentioned below from the contractors registered in appropriate class as mentioned below.			
Sr.	Name of work	Estimate Amount	Contractor's Registration
1	Improvement and widening of Bhuj Bhachau road (SH-42) Kln. 0/0 to 77/700 in the state of Gujarat on B.O.T. basis: km.2/500 to 77/00.	3202.81 Lac	Sp. Cat.I (Road) with "Class-AA"
Tender for the work will be available from dt.01/06/22 to dt.21/06/22 on our website: rnb.nprocure.com . Bidders are instructed to scan all required documents online by scanning. Pre-Bid meeting for the above work will be held at our circle office, Mehsana at 11.30 AM on dtd.16/06/22. For further details please contract on our above mentioned office address & for online submission of tender please visit our website mentioned above. Right to reject the tender is reserved. (DDI-KUTCH-231-2022)			



Gujarat Rural Industries Marketing Corporation Ltd.

(A Government of Gujarat undertaking)

Block No. 17, 5th Floor, Udyog Bhavan, Sector -11,
Gandhinagar - 382011, Tele No. 079-232-27243, 232 23763
E - mail : fairindextc@gmail.com

75th Anniversary

आजारी ७५^{वां} अमृत महोत्सव


ONLINE TENDER NOTICE : indextc/01/2022-23

Index-C. invites the Online E- Tender for execution of temporary stall, Electrical works, Fire safety works, CCTV and related structures with event management for arranging exhibition cum sale at various places of Gujarat and other States as per the Demand given in tender document.

Description	Tender Duration
Online Submission of Financial bid and all Technical documents.	On 30.05.2022 to 20.06.2022 up to 18:00 hrs.
Pre - Bid Meeting	On 09-06-2020, 12:00hrs.

All Physical tender documents can be downloaded free from web site www.nprocure.com. All Online submitted documents must be submitted physically also.

Managing Director



VADILAL INDUSTRIES LIMITED

Regd. Office: "Vadilal House", Shrimali Society, Nr. Navrangpura Crossing,
Navrangpura, Ahmedabad- 380 006,
Ph.: 079-26407201-09, **Fax:** 079-30153102, **Web:** www.vadilalgroup.com,
CIN: L91110GJ1982PLC005169, **Email:** shareslogs@vadilalgroup.com

ISO 22000-2005
Certified by BVQI
(BRC (British Retail Consortium)
Food Global Standard 2005)

EXTRACT OF AUDITED CONSOLIDATED AND STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2022

(Rs. In Lacs except per share data)

Particulars	Consolidated		Standalone			
	Year ended		Quarter ended		Year ended	
	31st March, 2022	31st March, 2021	31st March, 2022	31st March, 2021	31st March, 2022	31st March, 2021
	(Audited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)
Total income from operations (net)	70,602.92	47,988.69	17,821.12	14,212.36	55,290.75	36,856.19
Net Profit for the Period before tax, Exceptional Items and Extraordinary Items	6,383.06	768.48	2,478.17	964.26	1,414.94	(3,170.71)
Net Profit for the period before tax (after Exceptional and Extraordinary Items)	6,383.06	768.48	2,478.17	964.26	1,414.94	(3,170.71)
Net Profit for the period after tax	4,470.09	462.76	1,828.27	691.24	1,034.43	(2,409.82)
Total Comprehensive Income for the period	4,626.76	401.86	1,763.45	713.66	965.12	(2,407.37)
Equity Share Capital	718.78	718.78	718.78	718.78	718.78	718.78
Reserves (excluding Revaluation Reserve)	21,491.14	16,864.31			13,700.75	12,735.63
Earnings Per Share (of Rs. 10/- each)						
Basic & Diluted :	62.19	6.44	25.44	9.62	14.39	(33.53)

Note :

1. The above is an extract of the detailed format of Audited Financial Results of the Company for the Quarter and Year ended on 31-03-2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results of the Company for the Quarter and Year ended on 31-03-2022 are available on website of BSE, NSE and on Company's website viz www.vadilalgroup.com

2. The above Financial results were Reviewed by Audit Committee and subsequently approved by the Board of Directors at their Meeting held on 28th May, 2022.

FOR VADILAL INDUSTRIES LIMITED

RAJESH R. GANDHI

MANAGING DIRECTOR

Date : 28-05-2022

Place : Ahmedabad

VADILAL ENTERPRISES LIMITED

Regd.Office: 10th Floor, Colonnade Building,
Opp. Iscon BRTS Bus Stop, Ambli- Bopal Road, Ahmedabad-380015.
Ph.: 079-48081212, **Web:** www.vadilalgroup.com,
CIN: L51100GJ1985PLC007995, **Email:** shareslogs@vadilalgroup.com

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2022

(Rs. In Lacs except per share data)

Particulars	Quarter ended		Year ended	
	31st March, 2022	31st March, 2021	31st March, 2022	31st March, 2021
	(Audited)	(Audited)	(Audited)	(Audited)
Total income from operations (net)	16,349.05	12,682.27	55,208.52	34,393.02
Net Profit for the Period before tax, Exceptional Items and Extraordinary Items	(568.78)	(247.18)	300.11	122.79
Net Profit for the period before tax (after Exceptional and Extraordinary Items)	(568.78)	(247.18)	300.11	122.79
Net Profit for the period after tax	(430.07)	(191.48)	219.71	85.37
Total Comprehensive Income for the period	(481.55)	(173.12)	170.03	87.75
Equity Share Capital	86.27	86.27	86.27	86.27
Reserves (excluding Revaluation Reserve)				
Earnings Per Share (of Rs. 10/- each)				
Basic :	(49.85)	(22.20)	25.47	9.90
Diluted:				

Note :


- The above is an extract of the detailed format of Audited Financial Results of the Company for the Quarter and Year ended on 31-03-2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results of the Company for the Quarter and Year ended on 31-03-2022 are available on website of BSE and on Company's website viz www.vadilalgroup.com
- The above Financial results were Reviewed by Audit Committee and subsequently approved by the Board of Directors at their Meeting held on 28th May, 2022.

FOR VADILAL ENTERPRISES LIMITED

RAJESH R. GANDHI
CHAIRMAN & DIRECTOR

Date : 28-06-2022

Place : Ahmedabad



**GLOBAL HOSPITAL
AND RESEARCH LIMITED**

CIN: U85110GJ2012PLC068700

Registered Office: Global Hospital, Opp. Auda Garden, Nr. Water Tank, Bodakdev, Ahmedabad - 380054, Gujarat, India | Tel:-079-29708041

Email Id: investor@globalhospital.co.in | Website: www.globalhospital.co.in

Extract of Consolidated Financial Results for the Half Year and Year Ended 31st March, 2022

		(Rs. In Lakhs except per share data)		
Sr. No.	Particulars	Half-Yearly 31.03.2022	Yearly 31.03.2022	
		Audited	Audited	Audited
1	Total income from operations (net)	1,303.40	3,304.33	3,276.59
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)#	(45.58)	571.01	175.76
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(45.58)	571.01	175.76
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(259.20)	357.39	204.70
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	—	—	—
6	Equity Share Capital	700.00	700.00	700.00
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	996.22	996.22	667.70
8	Earnings Per Equity Share (of Rs. 10/- each) (for continuing operations) -			
	Basic :	(3.70)	5.11	2.92
	Diluted:	(3.70)	5.11	2.92
9	Earnings Per Equity Share (of Rs. 10/- each) (for continuing operations) -			
	Basic :	—	—	—
	Diluted:	—	—	—

Note:

a) The above is an extract of the detailed format of Half Yearly and yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half Yearly and yearly Financial Results are available on the websites of the Stock Exchange at www.bseindia.com and the company at www.globalhospital.co.in.

b) The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on May 30, 2022.

For, Global Longife Hospital And Research Limited

Dhruv Jani

Director (DIN:03154680)

Place: Ahmedabad

Date: 30.05.2022

Vikram
THERMO (INDIA) LTD.

Regd. Office : /A704-714, THE CAPITAL, Science City Road, Ahmedabad-380060, Gujarat, India
Phone: +91-79-48481010/11/12 E-mail: exports@vikramthermo.com
Website: www.vikramthermo.com

**EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS
FOR THE QUARTER ENDED ON 31-03-2022**

(Rs.in Lakhs)				
Sr no	Particulars	Quarter ended on 31st March, 2022	For the year ended on 31st March, 2022	Corresponding 3 Months Ended on 31st March, 2021
1	Total income from operations	2450.93	9333.18	1779.27
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	338.16	1176.54	162.98
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	338.16	1176.54	162.98
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	246.58	868.97	133.26
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	248.01	871.95	142.05
6	Equity Share Capital	627.16	627.16	627.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year		6719.88	
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)			
	Basic :	3.93	13.86	2.12
	Diluted :	3.93	13.86	2.12

Notes :

- 1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com) The same is also available on the Company's website at www.vikramthermo.com
- 2 The result of the quarter ended on 31st March, 2022 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 30/05/2022.

**BY ORDER OF THE BOARD OF DIRECTORS,
FOR, VIKRAM THERMO (INDIA) LTD.**

(D. K. PATEL)

[Managing Director]

(DIN 00044350)

Place: Ahmedabad

Date : 30/05/2022

adani
Ports and Logistics

Adani Ports and Special Economic Zone Ltd.

Notice to Shareholders for transfer of equity shares of the Company to the Demat Account of Investor Education and Protection Fund (IEPF) Authority

This notice is published pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("The IEPF Rules") notified by the Ministry of Corporate Affairs as amended from time to time.

The IEPF Rules, amongst other matters, contain provisions for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more in the name of Investor Education and Protection Fund Authority ("IEPF Authority").

Accordingly, shares of those shareholders who have not encashed their dividend for seven consecutive years from 2014-15 (Final Dividend) will be transferred to the IEPF Authority. The list of shareholder(s) whose shares are liable to be transferred to the IEPF Authority is uploaded on the website of the Company at www.adaniports.com.

Shareholders are requested to note that both the unclaimed dividend and the shares transferred to the IEPF Authority including all benefit on such shares, if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed under the IEPF Rules.

The Shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to the IEPF Authority, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of the transfer of shares to IEPF Authority as per the IEPF Rules and upon such issue, the original share certificate(s) which are registered in their name will automatically stand cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of the new share certificate(s) by the Company for the purpose of transfer of shares to the IEPF Authority pursuant to the IEPF Rules.

Pursuant to the provisions of the IEPF Rules, the Company has sent individual notices to the latest available addresses of the shareholders whose dividends are lying unpaid/unclaimed for the last seven consecutive years or more, inter-alia, providing details of shares to be transferred to IEPF Authority.

The Shareholder may note that if no reply is received by the Company or by the Registrar & Share Transfer Agent from the concerned shareholders by September 13, 2022, the Company shall, with a view to comply with the requirements as set out in IEPF Rules, transfer the shares to the IEPF Authority by the due date without any further notice.

For any information/clarifications on this matter, please contact the Company's Registrar and Share Transfer Agent – M/s. Link Intime India Private Limited, C-101, 247 Park, L B S Marg, Vikhroli (West), Mumbai-400083, Maharashtra, India.

For Adani Ports and Special Economic Zone Limited
Sd/-
Kamlesh Bhadia
Company Secretary

Date: 30-05-2022
Place: Ahmedabad

Regd. Office: "Adani Corporate House", Shantigram, Nr. Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar, Ahmedabad – 382421, Gujarat, India | **Phone No.:** +91 79 26565555 | **Fax No.:** +91 79 25555500
Website: www.adaniports.com | **CIN:** L6309OGJ1998PLC034182

</